

નામ સુપ્રીમ કોર્ટ મેટર
ટોચ અગ્રતા

ક્રમાંક: UDUHD/MSM/e-file/18/2023/2387/R Section

ગુજરાત સરકાર,

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ,

સચિવાલય, ગાંધીનગર.

પ્રતિ,

- મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ.
- મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત.
- મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા.
- મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ.
- મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, જામનગર.
- મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાવનગર.
- મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, જુનાગઢ.
- મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ગાંધીનગર.
- કમિશ્નરશ્રી, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી, ગાંધીનગર.

વિષય: WRIT PETITION(CIVIL) NO(S). 324 OF 2020
DR. BALRAM SINGH Vs UNION OF INDIA & ORS.

શ્રીમાન,

ઉપર્યુક્ત વિષય પરત્વે આ સાથે સામેલ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૨૫/૧૦/૨૦૨૩ના પત્ર અન્વયે જણાવવાનું કે, WRIT PETITION(CIVIL) NO(S). 324 OF 2020 DR. BALRAM SINGH Vs UNION OF INDIA & ORS. કેસમાં નામ સુપ્રીમ કોર્ટ દ્વારા તા.૨૦/૧૦/૨૦૨૩ના હુકમથી ગટર સફાઈ દરમિયાન સફાઈ કામદારોના થતા મૃત્યુ તથા ગટર સફાઈ દરમિયાન ઉદભવતી દિવ્યાંગતાના કિસ્સામાં વળતરના ચુકવણા માટે નીચે મુજબના આદેશ આપવામાં આવેલ છે.

- The court hereby directs the Union and the States to ensure that the compensation for sewer deaths is increased (given that the previous amount fixed, i.e., Rs 10 lakhs) was made applicable from 1993. The current equivalent of that amount is Rs.30 lakhs. This shall be the amount to be paid, by the concerned agency, i.e., the Union, the Union Territory or the States as the case may be. In other words, compensation for sewer deaths shall be Rs 30 lakhs. In the event, dependents of any victim have not been paid such amount, the above amount shall be payable to them. Furthermore, this shall be the amount to be hereafter paid, as compensation.
- Likewise, in the case of sewer victims suffering disabilities, depending upon the severity of the disabilities, compensation shall be disbursed. However, the minimum compensation shall not be less than Rs. 10 lakhs. If the disability is permanent, and renders the victim economically helpless, the compensation shall not be less than Rs. 20 lakhs.

૨. નામ સુપ્રીમ કોર્ટના તા.૨૪/૦૩/૨૦૧૪ના ચુકાદા મુજબ વર્ષ ૧૯૯૩ થી ગટર ગંગામણને કારણે મૃત્યુ પામેલ સફાઈ કામદારોના મૃત્યુના કેસમાં સફાઈ કામદારોના વારસદારોને રૂ.૧૦.૦૦ લાખનું વળતર ચુકવવા આદેશ આપવામાં આવેલ છે, જેમાં તા.૨૦/૧૦/૨૦૨૩ના ઉક્ત ચુકાદાથી વધારો કરીને રૂ.૩૦.૦૦ લાખ કરવામાં આવેલ છે. જો મૃતકોના વારસદારોને રૂ.૧૦.૦૦ લાખનું ચુકવણું કરવાનું બાકી હોય તેવા તમામ વારસદારોને રૂ.૩૦.૦૦ લાખનું ચુકવણું કરવાનું રહેશે. નામ સુપ્રીમ કોર્ટના તા.૨૦/૧૦/૨૦૨૩ના ચુકાદાથી ગટર સફાઈ દરમિયાન ઉદભવતી દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતા અનુસાર ન્યૂનતમ રૂ.૧૦.૦૦ લાખનું વળતર તથા કાયમી દિવ્યાંગતાના કિસ્સામાં ન્યૂનતમ રૂ.૨૦.૦૦ લાખનું વળતર ચુકવવા આદેશ કરવામાં આવેલ છે. વધુમાં નામ સુપ્રીમ કોર્ટ દ્વારા તા.૨૦/૧૦/૨૦૨૩ના ચુકાદાથી The Prohibition of Employment as Manual Scavengers and their Rehabilitation Act, 2013ના અસરકારક અમલીકરણ માટે નિર્દેશો આપવામાં આવેલ છે.

૩. ઉક્ત વિગતે, WRIT PETITION(CIVIL) NO(S). 324 OF 2020 DR. BALRAM SINGH Vs UNION OF INDIA & ORS. કેસમાં નામ સુપ્રીમ કોર્ટ દ્વારા તા.૨૦/૧૦/૨૦૨૩ના ચુકાદાથી આપવામાં આવેલ આદેશોનું પાલન કરવા તથા તે અંગે સંબંધિતો સૂચના અપાઈ જવા વિનંતી છે. વધુમાં, ગટર ગંગામણને કારણે મૃત્યુ પામનાર સફાઈ કામદારોના વારસદારોને ચૂકવણું કરવાનું બાકી છે તેની અત્રે ઉપલબ્ધ યાદી આ સાથે સામેલ છે, જે અંગેની અદ્યતન વિગતો આ વિભાગને મોકલી આપવા વિનંતી છે.

આપનો વિશ્વાસુ,
(કિશનસિંહ એલ. ઝાલા)

બિડાણ: ઉપર મુજબ

ઉપ સચિવ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ

